

૧) સાફલ્ય ગાથા (ફોટાઓ સાથે)

૨) સુરક્ષા સેતુ અંતર્ગત થયેલ કાર્યક્રમો તથા તેને અનુરૂપ ફોટાઓ વિગત

તા. ૨૧ ના વિશ્વ યોગ દિવસની ઉજવણી અનુસંધાને નવસારી જીલ્લા પોલીસ ધ્વારા રામજી મંદિર ના હોલ તેમજ ગ્રાઉન્ડમાં યોગ રાખવામાં આવેલ જેમા નવસારી ટાઉન, નવસારી રુરલ, જલ્લાલપોર, પોલીસ હેડ ક્વાર્ટર્સ, તેમજ બ્રાન્ચોના પોલીસ અધિકારી/ કર્મચારી તેમજ એન.જી.ઓ. રેવન્યુના કર્મચારીઓને ભાગ લીધેલ.



મુદા નંબર (૧)

૧. જીલ્લા શહેર કક્ષાએ કોઈ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ.
- નવસારી જીલ્લા પોલીસ ધ્વારા વર્ષ ૨૦૦૭ થી આજદિન સુધીના ગુમ થયેલ બાળકો/વ્યક્તિઓ શોધવા અંગે મીસીંગ ડ્રાઇવનું આયોજન કરી સગા સબંધીનો સંપર્ક કરી શોધવાની કામગીરી કરવામાં આવે છે.
- ગુમ થયેલ બાળકોને શોધવા વેબસાઇટ [http:// trackthemissingchild.gov.in/ missing/ index.php](http://trackthemissingchild.gov.in/missing/index.php) ઉપર ગુમ થયેલાની એન્ટ્રી ડે ટુ ડે કરવામાં આવે છે તેમજ મળી આવતા બાળકોની રીકવરીની એન્ટ્રી પણ કરવામાં આવે છે.
- અત્રેના જીલ્લાના બાકી રહેલ તમામ મીસીંગ ચાઇલ્ડ અંગેની માહિતી વેબસાઇટ પર અવનવુમાં મુકવામાં આવેલ છે.
- પી.સી.આર. વાન ચીખલી, બીલીમોરા, નવાસરી ટાઉન વિસ્તાર, નવસારી રુરલ, જલ્લાલપોર વિસ્તારમાં તાલીમ બદ્ધ ડ્રાયવરો તેમજ પોલીસ કર્મચારીઓ મુકી શરુ કરી ૧૦૦ નંબર પર કોલ કરવાથી હેલ્પ મળી રહે.
- ગુમ થયેલ બાળકો અંગે જીલ્લાની મહીલા સુરક્ષા સમિતીની મહીલાઓ તેમજ એન.જી.ઓ. ચાઇલ્ડ વેલ્ફેર ઓફીસર તેમજ જીલ્લાના તમામ અધિકારીઓ સાથે મીટીંગો કરવામાં આવે છે.
- નવસારી જીલ્લા પોલીસ ધ્વારા બાળ સુરક્ષામાં શિક્ષકોની ભુમિકા અંગે વારંવાર સેમિનારનું આયોજન કરવામાં આવે છે.

મુદા નંબર (૩)

- ટ્રાફિક અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ હોય.
- વારંવાર ટ્રાફિક અવેરનસ કાર્યક્રમો શાળા કોલેજોમાં ગોઠવવામાં આવે છે.
- ટ્રાફિક જનજાગૃતિ અંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી ટ્રાફિકના નિયમો સાથેની જાહેર જગ્યાઓ તેમજ શાળા કોલેજોમાં આર.ટી.ઓની મદદથી અવેરનસ કાર્યક્રમો રાખવામાં આવેલ.
- વારંવાર રોડ ઉપર ટ્રાફિક ડ્રાઇવ રાખી ટ્રાફિક અવેરનસ અંગેની સમજ આપવામાં આવે છે.

મુદા નંબર (૪)

- ગુનાઓ અટકાવવા કોઈ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટેજી અપનાવવામાં આવેલ છે ?
- નેશનલ ૮ તેમજ અન્ય રસ્તાઓ ઉપર એક્સીડન્ટ ઝોન કક્કી કરી રોડ એક્સીડન્ટ, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ સી.સી.ટી.વી. કેમેરાની જરૂરીયાત મુજબની યાદી બનાવી કલેક્ટરશ્રી સાથે મિટીંગો ગોઠવવામાં આવેલ છે.
- જીલ્લાના નવસારી ટાઉન-૨ નવસારી રુરલ- ૧૬, ચીખલી-૩૭, બીલીમોરા - ૨૩, ઉમરાટ, - ૮, દાંડી-૨ કેમેરા સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવેલ છે.
- નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નાઇટ રાઉન્ડ દરમિયાન સેક્ટરવાઇઝ ક્રોસ પેટ્રોલીંગ રાખેલ રાખવામાં આવે છે. હોટલો, ઢાબા, તેમજ વાહનોનું ચેકીંગ સઘન બનાવવામાં આવેલ છે.
- વારંવાર કોમ્પીંગ નાઇટ રાખી શક પડતા ઇસમો, અવાવરુ જગ્યા, રેલવે સ્ટેશન, હોટલ ધાબા, વાહન ચેકીંગ તેમજ નાકાબંધી રાખવામાં આવેલ છે.
- કાઇમ ઇન્સ્વેસ્ટીગ અંગે પોલીસના માણસોને સેમિનાર યોજી ગુનાઓ અટકાવવા તેમજ ઇન્સ્વેસ્ટીગમાં અવેરનસ આવે તે સારુ સેમિનારો યોજમાં આવે છે. ક્ષમતા વિકાસનું દરેક પોલીસ સ્ટેશન લેવલે આયોજન કરવામાં આવે છે.
- નવસારી જીલ્લા પોલીસ ધ્વારા બાળ સુરક્ષા અંગે સ્કૂલ કોલેજોમાં શિક્ષકો સાથે સેમિનાર યોજવામાં આવે છે.

મુદા નંબર (૫)

- અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરતજ ધ્યાન પર આવે તેવી બાબતો.
- સુરક્ષા સેતુ સોસાયટીના ભાગરુપે એસ.પી.સી. ના બાળકોને વિવિધ પ્રકારની તાલીમ કેમ્પ, સેમિનારનું આયોજન કરવામાં આવે છે.
- નેશનલ ૮ તેમજ અન્ય રસ્તાઓ ઉપર એક્સીડન્ટ ઝોન કક્કી કરી રોડ એક્સીડન્ટ, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ સી.સી.ટી.વી. કેમેરાની જરૂરીયાત મુજબની યાદી બનાવી કલેક્ટરશ્રી સાથે મિટીંગો ગોઠવવામાં આવેલ છે.
- જીલ્લાના નવસારી ટાઉન વિસ્તારમાં આવેલ ટ્રાફિક નિયમ, કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સીક્યુરીટી સીસ્ટમ અને સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.